



Axel Polymers Limited

Regd. Office & Works : 309, Mokshi, Sankarda-Savli Road, Tal. Savli,
Dist. Vadodara - 391780, India. • Telefax : +91-2667-244395, 244438
info@axelindia.com • www.axelindia.com • CIN : L 25200GJ1992PLC017678

06.11.2019

To,
The Secretary,
BSE Ltd.
25th Floor, Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Fort
Mumbai – 400 001

Dear Sir,

Sub: Newspaper Publication of Notice of 4/2019-20 Board Meeting.

Ref: Intimation under Regulation 47(1) (a) of SEBI (LODR) Regulations, 2015.


Dear Sir,

Pursuant to Regulation 47(1)(a) of the SEBI (LODR) Regulations, 2015, we would like to inform you that the Notice of 4/2019-20 of Board Meeting is scheduled to be held on Wednesday, the 13th November 2019 at 10.30 a.m. at its registered office of the Company inter alia, to consider and approve the Unaudited Financial Results of the Company and Limited Review Report for the quarter and half year ended 30th September, 2019, has been published in The "Business Standard" Newspaper Ahmedabad Edition and "Loksatta Jansatta" Gujarati Newspaper Vadodara Edition in English language on Wednesday, 06.11.2019.

Kindly take the above on your record and acknowledge the same.

Thanking you,

For Axel Polymers Limited


Jigardan Gadhvi
Company Secretary



orbit exports ltd.
 Regd. Office: 122, Misty Bhavan, 2nd Floor,
 Dinshaw Wacha Road, Churchgate, Mumbai - 400 020
 Ph: +91-22-6626262; Fax: +91-22-22822031;
 Email: investors@orbitexports.com; Website: www.orbitexports.com;
 CIN NO.: L40300MH1983PLC030872

NOTICE
 Notice is hereby given that pursuant to the provisions of Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Meeting of the Board of Directors of the Company is scheduled to be held on Tuesday, November 12, 2019, inter-alia to consider, approve and to take on record Unaudited Standalone and Consolidated Financial Results of the Company for the quarter and half year ended September 30, 2019. Further, the Trading Window for dealing in securities of the Company has been closed w.e.f. September 30, 2019, for designated persons and/or their immediate relatives and shall open on November 15, 2019. The said notice is also available on the website of the Company at www.orbitexports.com and on BSE website at www.bseindia.com and NSE website at www.nseindia.com.

For Orbit Exports Limited
 Sd/-
Neha Poddar
 Company Secretary
 Place : Mumbai
 Date : November 05, 2019

COSMO FILMS LIMITED
 Regd. Off: 1008, DLF Tower-A, Jasola District Centre, New Delhi-110025
 CIN: L92114DL1976PLC008355 Tel: 011-49494949 Fax: 011-49494950
 E-mail: investor.relations@cosmofilms.com, Website: www.cosmofilms.com

NOTICE
 Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, NOTICE is hereby given that a Meeting of Board of Directors of the Company will be held on **Wednesday, November 13, 2019** inter-alia:
 • To consider and approve the Un-Audited Financial Results of the Company for the Quarter ended as on 30th September, 2019.
 The said Notice has also been posted on the Company's website at www.cosmofilms.com and on the Stock Exchange websites at www.bseindia.com and www.nseindia.com.

For Cosmo Films Limited
 Sd/-
Jyoti Dixit
 Company Secretary
 Date: November 5, 2019
 Place: New Delhi

ALLAHABAD BANK
 Allahabad Bank, Surat Bombay Market Branch,
 Aditya Awas Building, Bombay Market, Umarwada,
 Surat 395010. Phone : 0261-2364804,
 Head Office : Kolkata, Zonal Office : Ahmedabad Fax: 0261-2355169

CORRIGENDUM
 Please refer to Bank's advertisement Published in Business Standard on 26/10/2019 for E-Auction of Bhagnwati Textile (Commercial Property Under Physical Possession) where below mentioned details found published incorrect, which please note and consider new correct details as under:

Incorrect	Correct
E-AUCTION DATE 30.11.2019	E-AUCTION DATE 16.11.2019
Reserve Price : For property at Lot 1. : Rs. 8.06 Lac Lot 2. : Rs. 8.06 Lac	Reserve Price : For property at Lot 1. : Rs. 7.63 Lac Lot 2. : Rs. 7.63 Lac
EMD : 10% of Reserve Price Lot 1. : Rs.0.81 Lac Lot 2. : Rs.0.81 Lac	EMD : 10% of Reserve Price Lot 1. : Rs.0.77 Lac Lot 2. : Rs.0.77 Lac
Last Date & time for Submission of Process compliance Form with EMD amount : On 28.11.2019 up to 4 PM	Last Date & time for Submission of Process compliance Form with EMD amount : On 14.11.2019 up to 4 PM

NOTE : Rest of the detail shall remain unaltered.
 Date: 05.11.2019, Place: Surat Chief Manager & Authorised Officer, Allahabad Bank

Recovery Branch, Surat City Region, Plot No. 6-B, 3rd Floor, Baroda Sun Complex, GhodDod Road, SURAT - 395007
 Ph: +91 221 229 4301/302, E-mail: sarbar@bankofbaroda.com

DEMAND NOTICE TO BORROWER Date : 24.10.2019
 (UNDER SUB-SECTION (2) OF SECTION 13 OF THE SARFAESI ACT, 2002)

To,
(1) Mr. Rohit Vinubhai Kasvala & (2) Mrs. Rupalben Rohit Kasvala
 Both at : (1) A-4-307 Vrajbhumi Town-2, Sarhana Jakatnaka, Varacha Surat. or (2) G 404 Vrajvillia Residency, Vraj Chowk, Simadagam, Surat-395006.
 Sub: Notice under section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, hereinafter called "The Act" in A/c Name: Mr. Rohit Vinubhai Kasvala and Mrs. Rupalben Rohit Kasvala.

Dear Sir/s,
 Re: Credit facilities with our Bank of Baroda, Khand Bazar, Surat.
 1. Referee to our letter no. BOB/ADV/ dated 26.02.2013 / 22.03.2013 AND BOB/ADV/ dated 28.02.2018 conveying sanction of various credit facilities and the terms of sanction. Pursuant to the above sanction you have availed and utilized the credit facilities after providing security for the same, as hereinafter stated. The present outstanding in various loan/credit facility accounts and the security interests created for such liability are as under:

Nature and type of Facility	Limit (in Lacs)	Rate of Interest	Security agreement with brief description of securities
Term Loan under Baroda Home Loan 073906/1188	Rs. 17.10	Under Floating option, 0.00% above business rate per annum with monthly rests.	Rs. 14,39,918.83 All right, title and interest in the immovable property bearing Flat No.404 (as per approved plan Flat No.402) admeasuring built-up area 82.50 sq. mtrs. and super built-up admeasuring 1365.00 sq.ft.s, on 4th Floor of "G" Building in the complex known as a "Vrajvillia Residency" along with undivided proportionate share in the underneath of the building situated on the land bearing Revenue Survey No.12/1-B having it's Block No.30, T.P. Scheme 68 (Puna-Simada), Final plot no.156 of Village : Simada, Sub-District : Puna, Surat City, District Surat in the name of Mr. Rohit Vinubhai Kasvala.
Term Loan under Baroda Home Loan 073906/1822	Rs. 12.00	Under Floating option, 1.50% above one year MCLR+ SP per annum with monthly rest	Rs. 13,07,323.01 A. Name of the Branch : Bank of Baroda, ROSARB, Baroda City Region B. Name of Borrower: Mrs Bindu Nitin Shah and Mr Nitin Subhaschandra Shah C. Total Dues: Rs 2731008/- (Rupees Twenty Seven Lakh Thirty One Thousand and Eight only) as per Demand notice u/s 13(2) dated 30-05-2016 + unapplied interest and charges w.e.f. 11-05-2016. D. Date/ Time of e-Auction: 27-11-2019 time - 01.00 AM TO 3.00 PM with unlimited extension of 5 min each.
Total	Rs. 29.10		Rs. 27,47,241.84

2. Consequently upon the defaults committed by you, your loan account has been classified as non-performing asset on 21-04-2019 in accordance with the Reserve Bank of India directives and guidelines. In spite of our repeated requests and demands you have not repaid the over due dues including interest thereon.
 3. Having regard to your inability to meet your liabilities in respect of the credit facilities duly secured by various securities mentioned in para 1 above, and classification of your account as a non-performing asset, we hereby give you notice under sub-section (2) of section 13 of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and call upon you to pay in full and discharge your liabilities to the Bank aggregating Rs. 27,47,241.84 (Twenty Seven Lacs Forty Seven Thousand Two Hundred Forty One and Eighty Four Paise Only) (Inclusive of interest up to 20.10.2019) as stated in para 1 above, within 60 days from the date of this notice. We further give you notice that failing payment of the above amount with interest till the date of payment, we shall be free to exercise all or any of the rights under sub-section (4) of section 13 of the said Act, which please note.
 4. Please note that, interest will continue to accrue at the rates specified in para 1 above for each credit facility until payment in full.
 5. We invite your attention to sub-section 13 of the said Act in terms of which you are barred from transferring any of the secured assets referred to in para 1 above by way of sale, lease or otherwise (other than in the ordinary course of business), without obtaining our prior written consent. We may add that non-compliance with the above provision contained in section 13(13) of the said Act, is an offence punishable under section 29 of the Act.
 6. We further invite your attention to sub-section (8) of section 13 of the said Act in terms of which you may redeem the secured assets, if the amount of dues together with all costs, charges and expenses incurred by the Bank is tendered by you, at any time before the date of publication of notice for public auction/involving quotations/tender/private treaty. Please note that after publication of the notice as above, your right to redeem the secured assets will not be available.
 7. Please note that this demand notice is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies which we may have, including without limitation, the right to make further demands in respect of sums owing to us.
 (Pratap Singh Meena)
 Chief Manager & Authorised Officer
 Bank Of Baroda, Surat.
 Date : 24.10.2019
 Note: Earlier Authorized Officer of bank has issued the demand notice dtd.02.05.2019 u/s.13 (2) of securitization Act-2002 to you. However, competent authority of bank has decided to withdraw demand notice dtd.02/05/2019 & all further consequential actions initiated by the bank against you under the provision of securitization Act-2002 with liberty to initiate fresh measures under the Act-2002 against you in accordance of law.

ROSARB - Baroda City Region, 4 th floor, Suraj Plaza-III Sayajiganj, Baroda-390005
 Email: sarbar@bankofbaroda.com
 Phone No. 0265-2225229 / Mobile No. 9898087348

APPENDIX-IV-A [See Proviso to rule 8(6)]
Sale notice for sale of immovable properties
 In exercise of power contained in the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (SARFAESI) Act, 2002 (No. of 54 of 2002), the Authorized Officer of Bank of Baroda have taken **symbolic possession** of the under mentioned secured asset which are held as securities in respect of credit facilities granted to the following borrower accounts mentioned below. It has been decided to sell the secured asset on "AS IS WHERE IS AND WHATEVER IS" and "WITHOUT RECOURSE BASIS" for realization of the secured debts due to Bank of Baroda. The sale will be done by the undersigned through e-auction platform provided at the website: <https://bob.auctiontiger.net>.

A. Name of the Branch : Bank of Baroda, ROSARB, Baroda City Region
 B. Name of Borrower: Mrs Bindu Nitin Shah and Mr Nitin Subhaschandra Shah
 C. Total Dues: Rs 2731008/- (Rupees Twenty Seven Lakh Thirty One Thousand and Eight only) as per Demand notice u/s 13(2) dated 30-05-2016 + unapplied interest and charges w.e.f. 11-05-2016.
 D. Date/ Time of e-Auction: 27-11-2019 time - 01.00 AM TO 3.00 PM with unlimited extension of 5 min each.

Lot no.	Description of the Immovable Property	Reserve Price EMD	Bid Amount
01	Flat no.401 Fourth floor, Tower -B, Planet World, B/H Dabholi-Dalshahad Bhavan, -Ajwa -Waghodia Road, admeasuring area flat 755 sq feet. R.S No 284 paiki east side of Bapod. T.P. No 3 FP No.3/3 Paiki Vadodara Bounded as North : Flat No B/402, South - OTS & Tower 'A', East-Stair/Passage & Flat No B/404 West : OTS, Nature of Property (Free hold) Encumbrances-Not known (except above)	1060000	1060000
02	Flat no.402 Fourth floor, Tower -B, Planet World, B/H Dabholi-Dalshahad Bhavan, -Ajwa-Waghodia Road, admeasuring area flat 755 sq feet. R.S No 284 paiki east side of Bapod. T.P. No 3 FP No.3/3 Paiki Vadodara Bounded as North : OTS South - Flat No B/401, East-Stair/ Passage & Flat No B/403, West : OTS Nature of Property (Free hold) Encumbrances-Not known (except above)	1060000	1060000

Date of e-Auction: 27-11-2019 from 1.00 p.m. to 3.00 p.m. (with unlimited extension of 5 minutes each) Last Date of submission of Bid 26-11-2019 Before 4-00 pm
 For detailed terms and conditions of the sale, please refer to the link provided in Bank of Baroda, Secured creditors website i.e. www.bankofbaroda.com and/or <https://bob.auctiontiger.net>. The auction-cum-sale shall be conducted through E-auction mode, through the official portal of <https://bob.auctiontiger.net>.
STATUTORY 15 DAYS SALE NOTICE TO THE BORROWER / GUARANTOR/ MORTGAGOR. THE ABOVE MENTIONED BORROWER/GUARANTOR ARE HEREBY NOTICED UNDER THE PROVISION OF RULES 8(5), 8(6) AND 9(1) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002.
 Place : Baroda
 Date : 06-11-2019
 (Sanjog J gandhi)
 Chief Manager & Authorized Officer

AVANSE FINANCIAL SERVICES
 CIN : U67120MH1992PLC068060
 Regd Office : 001 & 002 Fulcrum, A Wing, Ground Floor, Sahar Road, Next to Hyatt Regency, Andheri (East), Mumbai - 400 099
 T: 022 6859 9999 | F: 022 6859 9900
 Website : www.avanse.com | Email : investorrelations@avanse.com

Statement of Un-audited Financial Result for the Half Year Ended September 30, 2019
 (Rs. In lakhs)

Sr. No.	Particulars	Half Year Ended 30.09.2019	Half Year Ended 30.09.2018	Year Ended 31.03.2019
		(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total Income from operations	20,581.77	19,802.74	41,849.25
2	Net Profit / (Loss) before Tax	692.40	2,461.23	4,148.72
3	Net Profit / (Loss) after Tax	327.16	1,642.31	2,726.97
4	Paid-up Equity Share Capital	8,259.19	6,285.50	6,285.50
5	Reserves excluding Revaluation reserves	79,839.99	50,475.60	51,492.84
6	Networth	88,099.18	56,761.10	57,778.34
7	Paid up Debt capital/Outstanding debt	2,11,885.37	2,49,877.91	2,37,976.75
8	Debt equity ratio	2.41	4.40	4.12
9	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) - Basic and Diluted	0.46	2.69	4.40

Notes
 a) The above is an extract of the detailed format of Half Yearly Financial Results filed with the Stock Exchange under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Half Yearly result is available on the websites of BSE Limited and the Company at www.bseindia.com and www.avanse.com respectively.
 b) For the items referred in sub-clauses (a), (b), (d) and (e) of the Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to BSE Limited and can be accessed on www.bseindia.com
 c) Capital Redemption Reserve, Debenture Redemption Reserve, Debt Service Coverage Ratio and Interest Service Coverage Ratio are not applicable as per Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015.
 d) Previous period/year figures have been regrouped / reclassified wherever necessary to correspond with the current year classification/disclosure.

For Avanse Financial Services Ltd
 Sd/-
Neeraj Swaroop
 Chairperson
 (DIN 00061170)
 Place: Mumbai
 Date: November 5, 2019

Axel Polymers Limited
 CIN: L25200GJ1992PLC017678
 Regd. Off: S. No. 309, Vil. Mokshi, Tal Savli,
 Dist Vadodra 391780 Telefax: +91 2667 244395,
 Website: www.axelindia.com Email: cs@axelindia.com

NOTICE
 NOTICE is hereby given pursuant to Reg. 29 read with Reg. 47 of SEBI (LODR) Regulations, 2015 that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Wednesday, the 13-11-2019 at 10.30 a.m. at its registered office of the Company inter alia, to consider and approve the unaudited Financial Results of the Company for the quarter and half year ended 30-09-2019. This information is also available at the website of the Company and website of the Stock exchange at www.bseindia.com.

For Axel Polymers Limited
 Jigardan Gadnavi
 Company Secretary
 Date: 05.11.2019
 Place: Mokshi

ROSARB - Baroda City Region, 4 th floor, Suraj Plaza-III Sayajiganj, Baroda-390005
 Email: sarbar@bankofbaroda.com
 Phone No. 0265-2225229 / Mobile No. 9898087348

APPENDIX-IV-A [See Proviso to rule 8(6)]
Sale notice for sale of immovable properties
 In exercise of power contained in the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (SARFAESI) Act, 2002 (No. of 54 of 2002), the Authorized Officer of Bank of Baroda have taken **symbolic possession** of the under mentioned secured asset which are held as securities in respect of credit facilities granted to the following borrower accounts mentioned below. It has been decided to sell the secured asset on "AS IS WHERE IS AND WHATEVER IS" and "WITHOUT RECOURSE BASIS" for realization of the secured debts due to Bank of Baroda. The sale will be done by the undersigned through e-auction platform provided at the website: <https://bob.auctiontiger.net>.

A. Name of the Branch : Bank of Baroda, ROSARB, Baroda City Region
 B. Name of Borrower: M/s Jay Khodiyar Enterprise,
 C. Prop- Mrs. Madhuben Mohanbhai Patel
 D. Guarantor : Mr. Dhavnit Tarunkumar Vora
 E. Total Dues 3995248.00 (Thirty Nine Lakh Ninty Five Thousand Two Hundred Forty Eight only) as per Demand Notice u/s 13(2) dated 11-02-2019 + unapplied interest w.e.f. 01-01-2019
 F. Date/ Time of e-Auction: 27-11-2019 01.00 AM TO 3.00 PM with unlimited extension of 5 min each.

Lot no.	Description of the Immovable Property	Reserve Price EMD	Bid Amount
01	Flat No A/ 103 Tower-A on first floor admeasuring 167.28 Sq. Meters 1800 Sq ft super build area & Proportionate undivided share of land admeasuring 48.30 Sq sq meters in FLORENCE REGALIA being organized and constructed in the land bearing Revenue Survey No 250 Palki 1, T.P. SCHEME No. 16 F.P. No 73 (OP. No. 41/2) admeasuring 1152 Sq Meters of moje village Saiyed Vasna in the registration District & Sub District Vadodra Situated at opp. Kiritkunj Nagar- B/H Swaminarayan Temple , IsCon-Vasna Road Vadodra. Bounded : North: Compound Wall & Subhan Flat, South: Flat no - A/102, East: Passage, West :7.5 Meter Road Nature of Property (Free hold) Encumbrances-Not known (except above)	4244000	4244000
			5000

Date of e-Auction: 27-11-2019 from 1.00 p.m. to 3.00 p.m. (with unlimited extension of 5 minutes each) Last Date of submission of Bid 26-11-2019 Before 4-00 pm
 For detailed terms and conditions of the sale, please refer to the link provided in Bank of Baroda, Secured creditors website i.e. www.bankofbaroda.com and/or <https://bob.auctiontiger.net>. The auction-cum-sale shall be conducted through E-auction mode, through the official portal of <https://bob.auctiontiger.net>.
STATUTORY 15 DAYS SALE NOTICE TO THE BORROWER / GUARANTOR/ MORTGAGOR. THE ABOVE MENTIONED BORROWER/GUARANTOR ARE HEREBY NOTICED UNDER THE PROVISION OF RULES 8(5), 8(6) AND 9(1) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002.
 Place : Baroda
 Date : 06-11-2019
 (Sanjog J gandhi)
 Chief Manager & Authorized Officer

STOVEC INDUSTRIES LIMITED
 Regd. Office: N.I.D.C., Near Lambha Village, Post: NaroI, Ahmedabad - 382 405, Gujarat, India.
 Website: www.stovec.com, e-mail: secretarial@stovec.com, CIN: L45200GJ1973PLC050790
 Tel: +91(0)79 - 6157 2300, Fax: +91(0)79 - 2571 0406

Statement of Un-audited Financial Results for the Quarter and Nine Months Ended September 30, 2019
 (Rs. in Million)

Particulars	Current 3 months ended 30/09/2019	Preceding 3 months ended 30/06/2019	Previous Corresponding 3 months ended 30/09/2018	Current 9 months ended 30/09/2019	Previous Corresponding 9 months ended 30/09/2018	Previous year ended 31/12/2018
	(Unaudited)	(Unaudited)	(Unaudited) (Refer Note 1)	(Unaudited)	(Unaudited) (Refer Note 2)	(Audited) (Refer Note 2)
Total income from operations (net)	547.855	512.764	457.513	1,432.889	1,418.449	1,930.159
Net Profit for the period (before tax, Exceptional and/or Extraordinary items)	124.989	74.059	88.491	297.200	302.763	402.073
Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	124.989	74.059	88.491	297.200	443.844	543.154
Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	99.075	54.333	58.921	223.454	309.037	387.249
Total Comprehensive Income for the period [Comprising Profit (after tax) and Other Comprehensive Income (after tax)]	97.221	53.440	57.753	219.452	306.883	384.346
Paid up Equity Share Capital (Face value per share Rs. 10)	20.880	20.880	20.880	20.880	20.880	20.880
Earnings Per Share of Rs. 10 each (not annualised):						
a) Basic (Rs.) :	47.45	26.02	28.22	107.02	148.01	185.46
b) Diluted (Rs.) :	47.45	26.02	28.22	107.02	148.01	185.46

Notes:
 (1) The above is an extract of the detailed format of Unaudited Financial Results for the quarter and nine months ended September 30, 2019 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended. The full format of Unaudited Financial Results for the quarter and nine months ended September 30, 2019 are available on the Company's Website, www.stovec.com and on the BSE website, www.bseindia.com.
 (2) Pursuant to the Members' approval in 45th Annual General Meeting held on May 9, 2019, the Company has entered into Business Transfer Agreement with SPGPrints B.V. on 5.49 Million, determined based on the independent valuation report. The operational revenues and cost of operations of the current period for the said business is included in the "Textile Machinery and Consumables" segment of the Company.
 In accordance with the requirements of Appendix C of Ind AS 103 - Business Combination, the Company has presented the transaction retrospectively and accordingly previously published results has been restated to the extent, applicable.

For, Stovec Industries Ltd.
 Sd/-
 Shailesh Wani
 Managing Director
 (DIN: 06474766)

Place: Ahmedabad
Date: November 5, 2019

REDINGTON (INDIA) LIMITED
 Registered Office: SPL Guindy House, 95 Mount Road, Guindy, Chennai - 600 032.
 Website: www.redingtongroup.com | Email: investors@redington.co.in
 CIN: L52599TN1961PLC028758
 Board No: +91-44-42243353 | Fax No: +91-44-22253799

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter / Half Year Ended September 30, 2019
 ₹. in Crores

Sl. No.	Particulars	Consolidated			
		Quarter Ended	Quarter Ended	Half-Year Ended	Year Ended
		September 30, 2019	September 30, 2018	September 30, 2019	March 31, 2019
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1.	Revenue from operations	12,339.28	11,108.51	24,014.02	46,536.15
2.	Profit before exceptional item and tax	152.32	147.38	299.24	694.40
3.	Profit before tax	151.24	147.38	298.16	623.34
4.	Profit after exceptional item and tax	132.61	96.09	242.83	484.47
5.	Total comprehensive income	212.05	237.62	315.58	621.01
6.	Equity share capital	77.82	80.03	77.82	77.82
7.	Other equity as per balance sheet of previous accounting year	-	-	-	3,828.16
8.	Earnings per Equity Share: (Face Value - ₹ 2/- per share) (not annualized for quarters / Half Years)				
	1. Basic (in ₹)	3.34	2.62	6.17	12.80
	2. Diluted (in ₹)	3.34	2.62	6.17	12.80

Notes
 1. Summarized Standalone Financial Results of the Company is as under:
 ₹. in Crores

Sl. No.	Particulars	Standalone			
		Quarter Ended	Quarter Ended	Half-Year Ended	Year Ended
		September 30, 2019	September 30, 2018	September 30, 2019	March 31, 2019
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1.	Revenue from operations	4,796.92	4,171.14	8,872.75	16,851.21
2.	Profit before tax	195.89	64.10	249.79	225.78
3.	Profit after tax	162.27	48.01	196.83	152.14

2. The above is an extract of the detailed format of Quarterly / Half-Yearly / Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available in the website of the National Stock Exchange of India Limited (NSE) and BSE Limited (BSE) and are available in the Company's website www.redingtongroup.com.
 3. The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on November 4, 2019 and November 5, 2019.
 4. A Limited Review of the unaudited standalone and consolidated financial results of the Company has been carried out by the statutory auditors. A similar review of the financial results of the Subsidiaries / Associate has been conducted by the respective statutory auditors, as applicable.

For Redington (India) Limited
Raj Shankar
 Managing Director
 Place : Chennai
 Date : November 5, 2019

